

ત્વરિત જાહેરાત માટે

સીટી રિઓપનીંગ (ધંધાઓ ફરી ખોલવા) અને રિક્વરી માટે સમુદાયનો પ્રતિસાદ માગે છે

બ્રમ્પટન, ઓન્ટેરિયો (મે 12, 2020) – મેયરના રિઓપનીંગ એન્ડ રિક્વરી વર્કિંગ ગ્રૂપે શહેરમાં ધંધાઓનું રિઓપનીંગ જાહેર જનતા અને કર્મચારીઓની સેવા અને સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળતું હોવાની ખાતરી કરાવવા સમુદાયને વચનબદ્ધ થવાનો અભિગમ અપનાવવાની શરૂઆત કરી છે.

આમાં ચોક્કસ વપરાશકાર સમૂહો, ધંધાઓ અને સામુદાયિક સમૂહો સાથે શ્રેણીબદ્ધ સલાહ-મસલતો કરવાનો સમાવેશ થશે. મે 13 નાં રોજ, પહેલી વાર આવી સલાહ-મસલતો સ્પોર્ટ્સ ગ્રૂપ્સ સાથે યોજાઈ હતી.

બ્રમ્પટન સમુદાયને નવો શરૂ કરાયેલો રિઓપનીંગ એન્ડ રિક્વરી સર્વે જે [અહીં ઓનલાઇન ઉપલબ્ધ છે](https://www.brampton.ca/covid19reopencity@brampton.ca) તેમાં સહભાગી થઈને, અથવા covid19reopencity@brampton.ca ને ઈમેઇલ મોકલીને પોતાનો પ્રતિસાદ જણાવવા પણ આમંત્રિત કરવામાં આવ્યું છે.

રીજીયનલ કાઉન્સિલર માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros) ની આગેવાનીમાં અને બ્રમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસના માર્ગદર્શન પ્રમાણે, વર્કિંગ ગ્રૂપ સીટીમાં સગવડો સુરક્ષિતપણે અને ઉતાવળ કર્યા વગર કાળજીપૂર્વક ફરી શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગ્રૂપ તબક્કાવાર પુનઃશરૂઆત દરમિયાન વિશિષ્ટ COVID-19 ટાસ્ક ફોર્સને માર્ગદર્શન આપવા પ્રક્રિયાઓ પર સલાહ આપશે જેથી કરીને રહેવાસીઓને, ધંધાઓને અને કર્મચારીઓને પોતાને જરૂરી સહાયતા મળવાનું ચાલુ રહી શકે.

COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સીટી તરફથી અદ્યતન માહિતી મેળવવા વેબસાઇટ જુઓ, www.brampton.ca/COVID19

અવતરણો (ક્વોટ્સ):

“આપણાં શહેરની રિઓપનીંગ અને રિક્વરી માટેની યોજનાઓ છેવટે વિકસાવવાનું પ્રોવિન્સ અને પીલ પબ્લિક હેલ્થના અમારા ભાગીદારો અને તેઓના માર્ગદર્શન વડે ઘનિષ્ઠ સહયોગ પર નિર્ભર રહે છે. અમારું લક્ષ્ય COVID-19 નો ફેલાવો રોકવામાં વેગ જાળવી રાખતો સંકલિત પ્રતિભાવ સ્થાપવાનું છે. હું આપણાં સમુદાયની મહેનતું કામગીરી અને કટિબદ્ધતા બદલ આભારી છું અને આપણો પ્રતિભાવ ચાલુ રાખીએ છીએ ત્યારે તેઓની સતત સહાયતાની માગણી કરું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“શહેરને ધીરે ધીરે રિઓપનીંગ અને રિક્વરી માટે એક સુરક્ષિત, કાળજીપૂર્વક યોજના બનાવવાનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. અમે આ પ્રક્રિયામાં આગળ વધીએ ત્યારે અમે સમુદાયની સતત સહાયતા અને પ્રતિભાવ પર અવલંબિત છીએ. હું અમારી યોજનાઓ ઘડવામાં મદદરૂપ થતા શહેરના હોદ્દેદારો સાથે અર્થસભર ચર્ચાઓ કરવા અને એક વ્યાપક અભિગમની ખાતરી કરાવવા આશાવાદી છું.”

- માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; લીડ (આગેવાન), મેયરનું રિઓપનીંગ એન્ડ રિક્વરી વર્કિંગ ગ્રૂપ

“COVID-19 મહામારીની શરૂઆત થઈ ત્યારથી, આ શહેરે પોતાની સેવા અને કાર્યક્રમ વિતરણમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. છેવટે બંધી સંચાલન કામગીરીઓ ફરી ખોલવા અને પુનઃશરૂ કરવા પર ધ્યાન આપવામાં, અમારું ધ્યાન એકસરખું – આપણાં સમુદાયની સુખાકારી પર કેન્દ્રિત રહે છે. અમારો ધ્યેય આરોગ્ય અને સુરક્ષા પર અગ્રતા આપવાની સાથે સાથે, રહેવાસીઓ અને શહેરના તમામ હોદ્દેદારોની જરૂરિયાતો વચ્ચે કાળજીપૂર્વક સંતુલન કરવાનો છે.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडाल्मक संवाट

सीटी ओफ् ब्रम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca